

હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, મુવાલિયા ફાર્મ, દાહોદ હસ્તકની એગ્રી. પોલીક્લીનીક યોજના દ્વારા  
“શિયાળુ મકાઈ અને ચણાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને તેનું સંકલિત રોગ-જીવાત  
વ્યવસ્થાપણ” વિશે એક દિવસીય કેન્દ્રીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો

હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલિયા ફાર્મ, દાહોદ ખાતે ચાલતી યોજના “સ્પ્રેન્ધનીંગ ઓફ એગ્રી. પોલીક્લીનીક ફોર ટ્રાયબલ ફાર્મસ એટ દાહોદ” દ્વારા તા.૧૦-૧૧/૦૧/૨૦૧૮ ના રોજ “શિયાળુ મકાઈ અને ચણાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને તેનું સંકલિત રોગ-જીવાત વ્યવસ્થાપણ” વિષય પર એક દિવસીય કેન્દ્રીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. કેન્દ્રીય તાલીમ કાર્યક્રમમાં તા.૧૦-૧૧/૦૧/૨૦૧૮ ના રોજ દાહોદ જિલ્લાના ગામો ભોરવાડ, જેતપુર, વાકસીયા, કેશરપુર, જરોલા, રામા, કાલીયાકોટા, ધામરડા, ચોસાલા અને ખરોડના કુલ ૧૭૧ ખેડૂતભાઈઓ તેમજ બહેનો, કૃષિ વૈજ્ઞાનિકો અને કર્મચારીઓએ ભાગ લીધો હતો.

ડૉ. એસ. એ. ચૌહાણ (રિસર્ચ એસોસિએટ) એ પધારેલ ખેડૂતભાઈઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને કર્મચારીઓનું શાબ્દિક સ્વાગત કર્યું. ત્યારબાદ ડૉ. વાચ. બી ચૌહાણ (ઈ/યા યુનિટ વડા અને મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક) દ્વારા એક દિવસીય તાલીમ વિશે ઉદ્બોધન તેમજ ખેડૂતભાઈઓ, કૃષિ વૈજ્ઞાનિકો, કર્મચારીઓની ઉપસ્થિતિમાં દિવસ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું ઉદ્બઘાટન કરવામાં આવેલ હતું. કાર્યક્રમના ઉદ્બઘાટન બાદ કૃષિ નિષ્ણાતો દ્વારા જુદા જુદા વિષયો પર પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા પ્રત્યક્ષ ખેડૂતોને માહિતી આપેલ.

ડૉ. એસ. એ. ચૌહાણ (રિસર્ચ એસોસિએટ) એ એગ્રી.પોલીક્લીનીક યોજનાકીય, મકાઈના પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને જૈવિક પ્રવાહી વિશે માર્ગદર્શન આપેલ. ત્યારબાદ શ્રી એ. જી. પંપાણીયા (મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક) એ ચણાના પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે તેમજ ડૉ. વિકાસ પાલી (મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક) એ ચણાના પાકની નવીન જાતો, બીજ ઉત્પાદન અને રોંગીંગ અને ડૉ. એમ. એમ. પંડ્યા (મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક) એ મકાઈના પાકની નવીન જાતો, બીજ ઉત્પાદન તેમજ રોંગીંગ વિશે વિસ્તૃત માહિતી આપેલ. ડૉ. વાચ. બી ચૌહાણ (ઈ/યા યુનિટ વડા અને મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક) એ શિયાળુ મકાઈ અને ચણાના પાકમાં આવતા સંકલિત રોગ અને જીવાત નિયંત્રણનું પ્રત્યક્ષ ફોટા દ્વારા ખેડૂતોને માર્ગદર્શન અને કેન્દ્ર ખાતે ચાલતી શિક્ષણ, સંશોધન તેમજ વિસ્તરણની પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કર્યાં. શ્રી એમ. પી. રામાણી એ શિયાળુ મકાઈ અને ચણાના પાકમાં સંકલિત નિંદણ નિયંત્રણ વિશે માહિતીગાર કર્યાં.

ડૉ. વાચ. બી ચૌહાણ, ડૉ. એમ. એમ. પંડ્યા, ડૉ. એસ. એ. ચૌહાણ, શ્રી એ. જી. પંપાણીયા, શ્રી એમ. પી. રામાણી અને શ્રી આરીફ શેખ એ કેન્દ્ર હસ્તક ફાર્મની મુલાકાત કરાવેલ. ત્યાર બાદ ડૉ. વાચ. બી. ચૌહાણ, ડૉ. એમ. એમ. પંડ્યા, ડૉ. એસ. એ. ચૌહાણ એ પધારેલ ખેડૂતભાઈઓને હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર હસ્તક આવેલ મ્યુઝીયમની મુલાકાત કરાવેલ. સદર કાર્યક્રમનું આયોજન અને સફળ સંચાલન ડૉ. વાચ. બી ચૌહાણ, ડૉ. એમ. એમ. પંડ્યા, ડૉ. એસ. એ. ચૌહાણ, શ્રી આરીફ શેખ દ્વારા કરવામાં આવેલ હતું.

# ફોટોગ્રાફ



રજીસ્ટ્રેશન



શાબ્દિક સ્વાગત



દિપ પ્રાગટ્ય



“એગ્રી.પોલીકલનીક યોજનાકીય, મકાઈના પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને જૈવિક પ્રવાહી” વિશે માર્ગદર્શન આપતા વૈજ્ઞાનિક ડૉ. એસ. એ. ચૌહાણ

“ચણાના પાકની નવીન જાતો, બીજ ઉત્પાદન અને રોગીગ” વિશે માહિતી આપતા વૈજ્ઞાનિક ડૉ. વિકાસ પાલી

શિયાળુ મકાઈ અને ચણાના પાકમાં નિંદણ નિયંત્રણ વ્યવસ્થાપણ વિશે વ્યાખ્યાન આપતા શ્રી એમ. પી. રામાણી



“શિયાળુ મકાઈ અને ચણાના પાકમાં આવતા રોગ અને જીવાતના નિયંત્રણ વિશે” પ્રત્યક્ષ ફોટા દ્વારા ખેડૂતોને માર્ગદર્શન અને કેન્દ્ર ખાતે ચાલતી “શિક્ષણ, સંશોધન તેમજ વિસ્તરણની પ્રવૃત્તિઓ” વિશે માર્ગદર્શન આપતા વૈજ્ઞાનિક ડૉ. વાય. બી. ચૌહાણ





ચણા અને મકાઈના પાક વિશે ખેડૂતોને પ્રત્યક્ષ માર્ગદર્શન આપતા વૈજ્ઞાનિક  
ડૉ. એમ. એમ. પંડ્યા અને ડૉ. એસ. એ. ચૌહાણ



હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર તેમજ મ્યુઝીયમની મુલાકાત લેતા ખેડૂત ભાઈઓ